

- ૧) સાફલ્ય ગાથા (ફોટાઓ સાથે)  
૨) સુરક્ષા સેતુ અંતર્ગત થયેલ કાર્યક્રમો તથા



તેને અનુરૂપ ફોટાઓ વિગત સ્કુલોમાં અવરેનસ કાર્યક્રમ



પોલીસ સબ ઇન્સ્પેક્ટરની કચેરી, ગણદેવી  
ગણદેવી પોલીસ સ્ટેશન, તા.ગણદેવી જી.નવસારી  
(O) 02634-262233  
E-Mail ID: polstn-gal-nav@gujarat.gov.in  
sp-nav@gujarat.gov.in



પ્રેસ નોટ તા-૨૫/૦૯/૨૦૧૬

૫,૩૩,૬૦૦/- નો મુદ્દામાલ

ગણનાપાત્ર પ્રોહીનો કેસ શોધી

કાઢતી ગણદેવી પોલીસ

મે એસ.પી

સાહેબશ્રી એમ.એસ.ભરાડા

પોલીસ અધીક્ષકશ્રી તથા

ના.પો.અધિક્ષકશ્રી નવસારીનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અત્રેના પોલીસ સ્ટેશનમાં પ્રોહી તથા જુગાર અંગેના કેસો શોધી કાઢવા ડી.એસ.સોની પોલીસ સબ ઇન્સ્પેક્ટર ગણદેવી પોલીસ સ્ટેશનનાઓએ પોલીસ સ્ટાફના માણસો સાથે ગણદેવી પો.સ્ટે વિસ્તારમાં પ્રોહી જુગાર અંગે પેટ્રોલીંગમાં હતા દરમિયાન સાથેના પોલીસ માણસો પો.કો જયેશભાઈ લવજીભાઈ નાઓને બાતમી હકિકત મળેલ કે એક સ્વીફ્ટ કાર નં GJ-05-JK-8315માં કેટલાક ઇસમો પરપ્રાંત બનાવટનો ઇંગ્લીશ દારૂનો જથ્થો દમણ ખાતેથી ભરી સુરત તરફ જનાર છે જે બાતમી આધારે દુવાડા ગામે પ્રોહી નાકાબંધીમાં હતા તે દરમિયાન ઉપરોક્ત નંબરની કાર આવતા તેને રોકી સદર ગાડીમાં ચાર ઇસમો હોય જેમાં નં (૧) સચીન હસમુખલાલ દમણી ઉ.વ.૨૫ ઉધના પોલીસ સ્ટેશન સુરત શહેર રહે.ઉધના પોલીસ લાઇન રૂમ નં ૨૩ સુરત મુળ રહે.ગાંધીનગર સેક્ટર-૪ બી ૧૧૮૬/૨ ગાંધીનગર (૨) સુનિલભાઈ યોગેશચન્દ્ર શર્મા રહે ઉધના મહાકુંજ કોમ્પ્લેક્ષ રૂમ.નં ૧૮ ઉધના રેલ્વે સ્ટેશન પાસે સુરત તથા (૩) દિનેશભાઈ સુખદેવભાઈ ખંડારે રહે ઉધના સ્ટેશન રોડ ૦૧૦૭ સરદાર વલ્લભ પટેલ નગર ઘરનં ૨૨ સુરત (૪) અજીમખાન મુસ્તકીખાન પઠાણ રહે.ઉધના રોડ નં ૯ અશોક સમ્રાટ નગર ઘરનં ૩૫૨ મોરારજી વસાહત ઉધોગનગર ઉધના સુરત નાઓ પોતાના કબજાની સ્વીફ્ટ કાર નં GJ-05-JK-8315માં પરપ્રાંત બનાવટની વ્હિસ્કી તથા બીયરની બાટલીઓ નંગ-૩૯ કિ.રૂ.૩૩,૬૦૦/- તથા ગાડીની કિ.રૂ.૫,૦૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૫,૩૩,૬૦૦/-નો પ્રોહી મુદ્દામાલ વગર પાસ પરમીટે રાખી પકડાઈ ગયેલ હોય અને આરોપી નં ૧ નાની વધુ પુછપરછ કરતા તે પોતે ઉધના પોલીસ સ્ટેશન સુરત શહેર ખાતે પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે અને આગળની વધુ તપાસ પો.સ.ઇ ડી.એસ.સોની ગણદેવી પો.સ્ટે નાઓ કરી રહ્યા છે.

### મુદા નંબર (૧)

1. જીલ્લા શહેર કક્ષાએ કોઈ ખોવાયેલ બાળકો માટે ઝુંબેશ હાથ ધરવામાં આવેલ હોય, કે અન્ય સારી કામગીરી માટે ઝુંબેશ.
- નવસારી જીલ્લા પોલીસ ધ્વારા વર્ષ ૨૦૦૭ થી આજદિન સુધીના ગુમ થયેલ બાળકો/વ્યક્તિઓ શોધવા અંગે મીસીંગ ડ્રાઇવનું આયોજન કરી સગા સબંધીનો સંપર્ક કરી શોધવાની કામગીરી કરવામાં આવે છે.
- ગુમ/અપહરણ થયેલ બાળકોની ભારત સહકાર ધ્વારા શરૂ કરવામાં આવેલ વેબસાઇટ [http:// trackthemissingchild.gov.in/ missing/ index.php](http://trackthemissingchild.gov.in/missing/index.php) ઉપર રોજ રોજ એન્ટ્રી કરવામાં આવે છે.
- પી.સી.આર. વાન ચીખલી, બીલીમોરા, નવાસરી ટાઉન વિસ્તાર, નવસારી રુરલ, જલાલપોર વિસ્તારમાં તાલીમ બદ્ધ ડ્રાયવરો તેમજ પોલીસ કર્મચારીઓ મુકી શરૂ કરી ૧૦૦ નંબર પર કોલ કરવાથી હેલ્પ મળી રહે.
- ગુમ થયેલ બાળકો અંગે જીલ્લાની મહિલા સુરક્ષા સમિતીની મહિલાઓ તેમજ એન.જી.ઓ. યાઇલ્ડ વેલ્ફેર ઓફીસર તેમજ જીલ્લાના તમામ અધિકારીઓ સાથે મીટીંગો કરવામાં આવે છે.

### મુદા નંબર (૩)

- ટ્રાફિક અંગેના કાર્યક્રમો હાથ ધરવામાં આવેલ હોય.
- ટ્રાફિક સપ્તાહની ઉવજણી કરવામાં આવી રહેલ છે. ટ્રાફિક અવેરનસ અંગે શાળા કોલેજોમાં કાર્યક્રમો કરવામાં આવે છે.
- ટ્રાફિક જનજાગૃતિ અંગે ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવી ટ્રાફિકના નિયમો સાથેની જાહેર જગ્યાઓ તેમજ શાળા કોલેજોમાં આર.ટી.ઓની મદદથી અવેરનસ કાર્યક્રમો રાખવામાં આવેલ.
- વારંવાર રોડ ઉપર ટ્રાફિક ડ્રાઇવ રાખી ટ્રાફિક અવેરનસ અંગેની સમજ આપવામાં આવે છે.

### મુદા નંબર (૪)

- ગુનાઓ અટકાવવા કોઈ વિશિષ્ટ કામગીરી/સ્કેટેજ અપનાવવામાં આવેલ છે ?
- નેશનલ ૮ તેમજ અન્ય રસ્તાઓ ઉપર એક્સીડન્ટ ઝોન નક્કી કરી રોડ એક્સીડન્ટ, ટ્રાફિક નિયમન, કાયદો અને વ્યવસ્થાની જાળવણી સારુ સી.સી.ટી.વી. કેમેરાની જરૂરીયાત મુજબની યાદી બનાવી કલેક્ટરશ્રી સાથે મિટીંગો કરવામાં આવેલ છે.
- જીલ્લાના નવસારી ટાઉન-૨ નવસારી રુરલ- ૧૬, ચીખલી-૩૭, બીલીમોરા - ૨૩, ઉમરાટ, - ૮, દાંડી-૨ કેમેરા સુરક્ષા અને કાયદો અને વ્યવસ્થાની દ્રષ્ટિએ સીસીટીવી કેમેરા કાર્યરત કરવામાં આવેલ છે.
- નેશનલ હાઇવે નંબર ૮ ઉપર નાઇટ રાઉન્ડ દરમિયાન સેક્ટરવાઇઝ કોસ પેટ્રોલીંગ કરવામાં આવે છે. હોટલો, ઢાબા, તેમજ વાહનોનું ચેકીંગ સઘન બનાવવામાં આવેલ છે.
- વારંવાર કોમ્પ્લીંગ નાઇટ રાખી શક પડતા ઇસમો, અવાવરુ જગ્યા, રેલવે સ્ટેશન, હોટલ ધાબા, વાહન ચેકીંગ તેમજ નાકાબંધી રાખવામાં આવેલ છે.
- કાઇમ ઇન્વેસ્ટીગ અંગે પોલીસના માણસોને સેમિનાર યોજી ગુનાઓ અટકાવવા તેમજ ઇન્વેસ્ટીગમાં અવેરનસ આવે તે સારુ સેમિનારો યોજમાં આવે છે. ક્ષમતા વિકાસનું દરેક પોલીસ સ્ટેશન લેવલે આયોજન કરવામાં આવે છે.

### મુદા નંબર (૫)

- અન્ય લોકહિતની બાબતો જે લોકોના તુરતજ ધ્યાન પર આવે તેવી બાબતો.
- સુરક્ષા સેતુ સોસાયટીના ભાગરુપે એસ.પી.સી. ના બાળકોને વિવિધ પ્રકારની તાલીમ કેમ્પ, સેમિનારનું આયોજન કરવામાં આવે છે.
- નેશનલ હાઇવે નંબર ૮ તેમજ અન્ય રસ્તાઓ ઉપર એક્સીડન્ટ ઝોન કક્કી કરી રોડ એક્સીડન્ટ, ટ્રાફિક નિયમન, કાયદો અને વ્યવસ્થાની જાળવણી સારુ સી.સી.ટી.વી. કેમેરાની જરૂરીયાત મુજબની યાદી બનાવી કલેક્ટરશ્રી સાથે મિટીંગો ગોઠવવામાં આવેલ છે.
- જીલ્લાના નવસારી ટાઉન વિસ્તારમાં આવેલ ટ્રાફિક નિયમ, કાયદો અને વ્યવસ્થાની દ્રષ્ટિએ સીક્યુરીટી સીસ્ટમ અને સી.સી.ટી.વી. કેમેરાની વ્યવસ્થાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ.